

*The Supreme's power  
is infinite - it is  
our faith that is small  
with my blessings*

The Supreme's power is  
infinite - it is our faith that is  
small.


With my blessings

- The Mother

પરમ પ્રભુનું બળ અનંત છે- એ તો  
આપણી શ્રદ્ધા સીમિત હોય છે.

મારા આશીર્વાદ સાથે

- શ્રી માતાજી



# Prosperity

2019  
OCTOBER

૧ ઓક્ટોબર, ૨૦૧૯

શ્રી માતાજીની

સિદ્ધિ-રિદ્ધિ

— Unshakeable Faith —

— અચલ શ્રદ્ધા —

*In an unshakable  
faith lies all our  
hope.  
with my blessings*

In an unshakable faith lies all  
our hope.

With my blessings

- The Mother

એક અચલ શ્રદ્ધામાં આપણી બધી  
આશા રહેલી છે.

મારા આશીર્વાદ સાથે

- શ્રી માતાજી

*Faith is the surest  
guide in the darkest  
days.  
with my blessings*

Faith is the surest guide in the  
darkest days.

With my blessings

- The Mother

એકદમ અંધકાર ભરેલા દિવસોમાં શ્રદ્ધા  
જ એક ચોક્કસ માર્ગદર્શક છે.

મારા આશીર્વાદ સાથે

- શ્રી માતાજી

*Sri Aurobindo is always  
with us, enlightening,  
guiding, protecting.  
We must answer  
to his grace by a  
perfect faithfulness.  
with my blessings*

Sri Aurobindo is always with us, enlightening, guiding, protecting.  
We must answer to his grace by a perfect faithfulness.

With my blessings

- The Mother

શ્રી અરવિન્દ હમેશાં આપણી સાથે છે, આપણને પ્રકાશ આપતા, દોરતા, રક્ષણ  
કરતા. એમની કૃપાને આપણે એક સંપૂર્ણ વફાદારીથી પ્રત્યુત્તર આપવો જોઈએ.

મારા આશીર્વાદ સાથે

- શ્રી માતાજી

Mantras of the Mother : 23.8.1954 - 3.9.1954 - 16.8.1954  
શ્રી માતાજીના મંત્રો: ૨૩.૮.૧૯૫૪ - ૩.૯.૧૯૫૪ - ૧૬.૮.૧૯૫૪

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. © 0413-2331470  
રવાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨. © ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • October 2019  
<https://themothersprosperity.org>

Mantras of the Mother - 14 August 1954 / શ્રી માતાજીના મંત્રો - ૧૪ ઓગસ્ટ ૧૯૫૪

**There** is a great difference between being in the midst of active work, of external action, while keeping one's thought constantly fixed on Thee, and entering into that perfect union with Thee which leads to what I have called "absolute Consciousness, true Omniscience, Knowledge". When one acts, though with the thought fixed on Thee, one is like a blind man walking on the road with a sense of direction, but knowing nothing about the path he is following and how, precisely, one must walk so as to neglect nothing. In the other case, on the contrary, there is the clear vision in full light, the utilisation of the least occasion, the plenitude of action, the maximum result. And if the first attitude is indispensable before acquiring the other, yet at no moment must one cease working, making an effort to attain perfect communion.

But my heart is in peace, my thought free from impatience, and I entrust myself to Thy will with the smiling confidence of a child.

May Thy peace reign over all. ...

- The Mother

**બાહ્ય** કાર્યમાં સક્રિયપણે જોડાયેલા રહેવું અને છતાં પોતાનો વિચાર અવિરતપણે તારી ઉપર એકાગ્ર રાખવો, અને તારી સાથે એક એવા પૂર્ણ એકત્વમાં પ્રવેશ કરવો કે હું જેને 'પરાત્પર ચેતના, સત્ય સર્વજ્ઞતા, જ્ઞાન-સ્વરૂપ' કહું છું, તેમાં એક આખો ફેર પડી જાય છે. જ્યારે અમે તારી ઉપર અમારો વિચાર એકાગ્ર રાખ્યો હોય છે અને કાર્ય કરતાં જતાં હોઈએ છીએ ત્યારે પણ, અમે એક એવા આંધળા મનુષ્ય જેવાં હોઈએ છીએ જે પોતાને કઈ દિશામાં જવું છે તે જાણતો હોય છે, પરંતુ પોતે જે માર્ગે ચાલી રહ્યો હોય છે તેના વિષે તે કંઈ જાણતો નથી હોતો અને પોતે એવી કઈ રીતે ચાલવું કે જેથી કોઈ પણ વસ્તુ પોતાના ધ્યાન બહાર ન જાય, તેની એને ખબર નથી હોતી. આથી ઊલટું, બીજી એક અવસ્થા એવી હોય છે, જેમાં પૂર્ણ પ્રકાશ સાથે ચોખ્ખી દૃષ્ટિ હોય છે, નાનામાં નાની તકનો સદુપયોગ કરવામાં આવતો હોય છે, ક્રિયામાં ભવ્યતા હોય છે, પરિણામ પણ મહાન હોય છે. અને, બીજા પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરવા માટે પ્રથમ પ્રકારનું વલણ ધરાવવું જો અનિવાર્ય હોય તો અમારે કોઈ પણ ક્ષણે કામ કરતા અટકવું ન જોઈએ, સંપૂર્ણ અદ્વેત પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરવાનો હોય છે તેમાંથી પાછા ન હઠવું જોઈએ.

પરંતુ મારું હૃદય શાંત છે, મારા વિચારો અધીરતાથી મુક્ત છે, અને હું મારી જાતને, એક બાળક સરખા સ્મિતપૂર્ણ વિશ્વાસ સાથે તારી ઇચ્છાને સમર્પી દઉં છું.

તારી શાંતિનું સામ્રાજ્ય સર્વ સ્થળે ફેલાઓ ...

- શ્રી માતાજી

**From** the time we started and every day more and more, in all things we can see Thy divine intervention, everywhere Thy law is expressed, and I need all my inner conviction to feel that this is perfectly natural, so that I do not pass from wonder to wonder.

At no moment do I feel that I am living outside Thee and never have the horizons appeared vaster to me and the depths at once more luminous and unfathomable. Grant, O Divine Teacher, that we may know and accomplish our mission upon earth better and better, more and more, that we may make full use of all the energies that are in us, and Thy sovereign Presence become manifest ever more perfectly in the silent depths of our soul, in all our thoughts, all our feelings, all our actions.

I find it almost strange to speak to Thee, so much is it Thou who livest in me, thinkest and lovest.

- The Mother

**નીકળ્યા** છીએ તે સમયથી અને રોજ વધુને વધુ, બધી જ વસ્તુઓમાં તારો દિવ્ય હસ્તક્ષેપ જોઈએ છીએ, તારો વિશ્વનિયમ વ્યક્ત થયેલો દેખાય છે, અને મારે મારા સમગ્ર આત્મવિશ્વાસની જરૂર છે કે આ બધું પૂરેપૂરું સ્વાભાવિક જ છે એમ સ્વીકારી શકું અને દરેક વસ્તુને એક પછી એક આશ્ચર્ય તરીકે જોવી ન પડે.

હવે એવી કોઈ ક્ષણ નથી કે જ્યારે હું તારી સાથે પૂર્ણ અદ્વેતમાં ન હોઉં. અત્યારે ક્ષિતિજો વિશાળ ને વિશાળ બની રહી છે અને ઊંડાણો એકદમ વધુ પ્રકાશમાન અને વધુ અતાગ બની રહેલાં છે. આવો અનુભવ મને ક્યારે પણ થયેલો નથી. હે દિવ્ય ગુરુ, અમારી પ્રાર્થના છે કે, પૃથ્વી ઉપર તારું જે કાર્ય છે તે અમે વધુ ને વધુ પ્રમાણમાં વધુ ને વધુ સારી રીતે જાણીએ અને તેને સિદ્ધ કરીએ, અમારી અંદર રહેલી સર્વ શક્તિઓનો અમે સંપૂર્ણ ઉપયોગ કરીએ, અને તારું પરમ સાંનિધ્ય અમારા આત્માનાં નીરવ ઊંડાણોની અંદર અમારા સર્વ વિચારોમાં, અમારી સર્વ લાગણીઓમાં, અમારાં સર્વ કર્મોમાં વધુ ને વધુ સંપૂર્ણ રીતે આવિર્ભાવ પામી રહે.

હું તને આ સંબોધન કરું છું એ મને કંઈક વિચિત્ર જેવું લાગે છે, કારણ મારી અંદર હવે તો તું જ વસી રહ્યો છે, તું જ વિચારી રહ્યો છે અને તું જ પ્રેમ કરી રહ્યો છે.

- શ્રી માતાજી